

અરજદારની બી.એન.એસ.એસ ની કલમ ૪૯૭ અને ૫૦૩ મુજબની અરજી લગત હુકમ

(૧) અરજદારશ્રી MANOJBHAI KISHORBHAI PATEL ની હાલની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિધ્વાન એ.પી.પી.શ્રી ને સાંભળ્યા, રજુ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.

હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે, તેઓ અરજી માં જણાવ્યા મુજબના સરનામે હાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ જે બનાવમાં તેઓના અરજદારના (1) SBI બેન્ક ના ખાતા નંબર- ૩૪૫૧૧૨૩૨૬૨૨ , બેંક ઓફ ઈન્ડિયા ના ખાતા નંબર-૨૭૫૧૧૦૧૧૦૦૦૧૦૭૩ તથા THE SURAT DISTRICT CO.OPERATIVE BANK LTD. બેંક ના ખાતા નંબર- ૮૦૮૦૩૭૦૦૮૮૧૫ માંથી કુલ રૂ- 59,50,153/- ઉપડી ગયેલ હતા. જે બાબતે તેઓએ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930/100 ઉપર કોલ કરીને ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદ તારીખ 04/06/2026 ના રોજ ટિકિટ નંબર ૩૧૧૦૬૨૬૦૧૨૭૦૧૪ થી નોંધાવેલ હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેઓના ગયેલ નાણાં પૈકી સામાવાળાના

અનં.	બેંકનું નામ	ખાતા નંબર	ફિઝ રકમ
1.	Airtel Payments Bank	1020276560	1600
2.	Airtel Payments Bank	1020276560	1000
3.	Airtel Payments Bank	1020276560	1900
4.	AU Bank	2501222984973654	575
5.	AU Bank	2221229442882618	1150
6.	Axis Bank	920020052362326	49000
7.	Axis Bank	923020002241128	70539.08
8.	Axis Bank	925010031989560	616.48
9.	Axis Bank	920010031828233	607.39
10.	Axis Bank	541010200001571	100000
11.	Axis Bank	921010013970265	598
12.	Bank of Baroda	14200100013442	47850.52
13.	Bank of Baroda	37900100016716	6000
14.	Bank of Baroda	71670100001728	7300
15.	Bank of Baroda	68740200001168	631
16.	Bank of Baroda	68740100003377	580
17.	Bank of India	310810310003256	5344.11
18.	Bank of India	311510110012542	2000

19.	Canara Bank	110063005772	521.91
20.	Canara Bank	110063005772	521.91
21.	Canara Bank	110291670735	5000
22.	Canara Bank	42302250003901	15000
23.	Canara Bank	6401101001009	19096
24.	Canara Bank	6401101001009	21096
25.	Canara Bank	0878201000917	37000
26.	Central Bank of India	5912654894	5380.81
27.	Central Bank of India	00000005172105182	3000
28.	Federal Bank	20170100039947	30000
29.	HDFC Bank	50200116507647	11241.29
30.	HDFC Bank	13461050008464	15000
31.	HDFC Bank	59208097730141	50000
32.	HDFC Bank	50200099949445	1078
33.	HDFC Bank	50200118823919	511
34.	ICICI Bank	613701505812	50000
35.	ICICI Bank	147501528257	3500
36.	ICICI Bank	033505003721	346800
37.	ICICI Bank	125105500317	29000
38.	IDFC First Bank	10149276249	47200
39.	IDFC First Bank	10077180943	50000
40.	IDFC First Bank	10012796253	50000
41.	IDFC First Bank	10248245322	109496.15
42.	Indian Bank	6755754376	3112.59
43.	Indian Bank	6774903554	1887.41
44.	Indian Bank	6774903554	30000
45.	Indian Bank	6130337329	10000
46.	Indian Bank	606686412	26500
47.	Indian Overseas Bank	157601000019184	21044.88
48.	Indian Overseas Bank	135601000015242	2983.79

49.	Jammu and Kashmir Bank	0019040100042448	9872.92
50.	Karur Vysya Bank	1698135000006240	10006
51.	Punjab National Bank	0190200100005415	9970.06
52.	Punjab National Bank	0190202100000203	2478.09
53.	Punjab National Bank	2243000100841175	4700
54.	Rajkot Nagrik Sahakari Bank	017003100042960	2800
55.	Rajkot Nagrik Sahakari Bank	017003100042960	2800
56.	State Bank of India	20234910549	70500
57.	State Bank of India	38100985731	2443.5
58.	State Bank of India	38456570913	1300
59.	State Bank of India	42144437636	1000
60.	State Bank of India	33300635957	25000
61.	State Bank of India	33300635957	1000
62.	State Bank of India	38949790259	20000
63.	State Bank of India	34828420751	15000
64.	State Bank of India	20409100821	25000
65.	State Bank of India	36515436649	127400
66.	State Bank of India	43823975348	300023.6
67.	State Bank of India	36177807721	600
68.	State Bank of India	30680989130	14200
69.	State Bank of India	31027651872	8435
70.	State Bank of India	40468523384	7853.91
71.	State Bank of India	43725742430	667
72.	State Bank of India	20409100821	20000
73.	State Bank of India	33300635957	25000
74.	State Bank of India	33230075366	228186
75.	The Junagadh Jilla Sahakari Bank Ltd	00000196004684007	5930.17
76.	UCO Bank	13860100016799	44619.19
77.	Yes Bank	018461900007822	2149.48
78.	Yes Bank	018450700006443	6000

79.	Yes Bank	009852000002533	2130
80.	Yes Bank	211074071	17500

માં રૂ. 23,07,828/- રૂપિયા બી.એન.એસ.એસ કલમ ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે, આ બાબતે એફ.આઇ.આર. થયેલ નથી. તેઓને ખુબજ મોટું આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે બી.એન.એસ.એસ ની કલમ ૪૯૭ અને ૫૦૩ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

(૨) અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરનાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહીત સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા હુકમ કરવામાં આવેલ.

જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, ગાંધીનગર નાઓએ તેઓનો અભિપ્રાય રજૂ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતા તેઓએ જણાવેલ છે કે, સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાણાં જ્યારે ઓનલાઇન ટ્રાન્સફર થઇ જતા હોય છે ત્યારે આવા નાણાને તાત્કાલીક રોકવા તથા ગુના અટકાવવા માટે ભારત સરકાર દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ હેઠળ હેલ્પ લાઇન સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે. જે હાલ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સીઆઇડી ક્રાઇમ હસ્તક ચાલુ છે અને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે આ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ખાતે ફરજ બજાવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટમાં સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર નાણાં જ્યારે ઓનલાઇન ટ્રાન્સફર થઇ જતા હોય છે તેને તાત્કાલીક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરીકો સીધી જ પોતાની ફરીયાદ હેલ્પ લાઇન નંબર ૧૦૦/૧૯૩૦ પર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ દ્વારા એક ટીકીટ નંબર આપવામાં આવે છે તેમજ સાથોસાથ જે શંકાસ્પદ બેન્ક ખાતામાં જે-તે નાગરીકના નાણાં ગયેલ હોય તે બેન્ક ને નાણાં ફીઝ કરાવવા તેમજ જો નાણાં ત્યાંથી ટ્રાન્સફર થઇ ગયેલ હોય તો તેની માહિતી આપવા માટે તેઓની કચેરીએથી બી.એન.એસ.એસ ની કલમ ૯૪ તથા ૧૦૬ હેઠળ નોટીસ આપવામાં આવે છે. નોટીસ આધારે બેન્કો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણાં ફીઝ કરવામાં આવે છે.

વધુમાં અરજદારની અરજીની હકિકતો જણાવી વાદગ્રસ્ત રકમ સીઆરપીસી કલમ ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણાં પાછા ખેંચવા માટે અરજદારશ્રીએ આપ નામદાર સાહેબની કોર્ટમાં અરજી કરેલ હોય અને તે સાચું તેઓનો અભિપ્રાય માંગેલ છે. જે બાબતે તેઓએ જણાવેલ છે કે, જે ખાતા માં રૂપિયા ફીઝ થયેલ છે જે સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાઇ આવેલ છે તથા સદરખૂ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઇ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઇ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રૂપિયા અરજદારશ્રી ને પાછા આપવા તેઓનો અભિપ્રાય થાય છે.

(૩) સદર કામે અરજી સાથે રજૂ કરવામાં આવેલ બેન્ક પેપર્સની નકલ ધ્યાને લેતા તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા રજૂ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતા ફરીયાદીના ખાતામાંથી નાણાં ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેન્કના ખાતામાં ટ્રાન્સફર થયાનું હાલના તબક્કે સ્પષ્ટ જણાઇ આવે છે. તદ્દુપરાંત રેકર્ડ પરની હકીકત ધ્યાને લેતા હાલના કામે આજદીન સુધી કોઇ એફઆઇઆર થયેલ હોય કે હાલના કામે કોઇની ધરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઇ આવતું નથી. તેમજ બનાવ બન્યે આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદીન સુધી અરજદાર સિવાય અન્ય કોઇએ સદર નાણાંની અત્રેની અદાલત સમક્ષ માંગણી કરતી કોઇ અરજી કરેલ નથી. તદ્દુપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને

લેતાં તેઓ સમક્ષ પણ કોઇએ આ નાણાંની માંગણી કરેલ હોય તેમ જણાતુ નથી. તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે તથા સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઇ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઇ વાંધા તકરાર લીધેલ નથી. જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા સદર નાણાં અરજદારશ્રીને પાછા આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણાંનો કબ્જો મેળવવા હક્કદાર હોવાનું જણાય છે.

(૪) આ તબક્કે સદર નાણા પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમત જોતા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ની કલમ ૪૫૭ માં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે.

કલમ- ૫૦૩

કોઇ પોલીસ અધિકારીએ મિલકત કબ્જે લીધાનો આ અધિનિયમની જોગવાઈ હેઠળ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરવામાં આવે અને તપાસ કે ઇન્સાફી કાર્યવાહી દરમિયાન ફોજદારી ન્યાયાલય સમક્ષ તે મિલકત રજુ ન કરવામાં આવે ત્યારે, મિલકતના નિકાલ સંબંધી અથવા તેનો કબ્જો ધરાવવા હકદાર વ્યક્તિને તે મિલકત સોંપી દેવા સંબંધી અથવા તે વ્યક્તિ અંગે ખાતરી કરી જાણી ન શકાય તો, તે મિલકતની કસ્ટડી અને તેને રજુ કરવા સંબંધમાં મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે હુકમ કરી શકશે.

આમ સદર કાયદાકીય જોગવાઈ મુજબ જ્યારે કોઇ પણ પોલીસ અધિકારી દ્વારા મિલકતની જપ્તીની જાણ મેજિસ્ટ્રેટને કરવામાં આવે અને તપાસ દરમિયાન આવી મિલકત અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ ન હોય ત્યારે મેજિસ્ટ્રેટ ને આવી મિલકતના નિકાલ અથવા તો કબ્જા બાબતે યોગ્ય લાગે તેવો હુકમ કરવાની સત્તા આપવામાં આવેલ છે.

આમ ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતાં સદર નાણાં બેન્ક માં જમા હોય તેથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમજ ભવિષ્યે પણ મુદ્દામાલ ની ઓળખ બાબતની કોઇ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુ માં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરા રાજ્ય, ૨૦૦૩(૧) જી.એલ.એચ.પાના નંબર ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિધ્ધાંતો ધ્યાને લેતા પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવા માં આવે છે.

હુકમ

- અરજદારશ્રી **RAHUL YOGESHBHAI MISTRY** ની અરજી આથી બી.એન.એસ.એસકલમ ૫૦૩ હેઠળ આથી મંજૂર કરવામાં આવે છે.
- અરજદારને સદર ગુનાના કામે અલગ અલગ બેન્કો સીઝ કરવામાં આવેલ કુલ રોકડ રકમ રૂ. 23,07,828/- પુરાની દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલી જ રકમના સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.
- વધુમાં હુકમ કરવામાં આવે છે કે, અરજદાર દ્વારા હુકમ મુજબના જાત જામીન તથા સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ ફરીયાદી તથા જેમાં નાણાં સીઝ થયેલ છે તે બેન્કને કરવી અને જે બેન્કમાં નાણાં ફીઝ થયેલ છે તે બેન્ક

અનં.	બેંકનું નામ	ખાતા નંબર	ફિઝ રકમ
1.	Airtel Payments Bank	1020276560	1600

2.	Airtel Payments Bank	1020276560	1000
3.	Airtel Payments Bank	1020276560	1900
4.	AU Bank	2501222984973654	575
5.	AU Bank	2221229442882618	1150
6.	Axis Bank	920020052362326	49000
7.	Axis Bank	923020002241128	70539.08
8.	Axis Bank	925010031989560	616.48
9.	Axis Bank	920010031828233	607.39
10.	Axis Bank	541010200001571	100000
11.	Axis Bank	921010013970265	598
12.	Bank of Baroda	14200100013442	47850.52
13.	Bank of Baroda	37900100016716	6000
14.	Bank of Baroda	71670100001728	7300
15.	Bank of Baroda	68740200001168	631
16.	Bank of Baroda	68740100003377	580
17.	Bank of India	310810310003256	5344.11
18.	Bank of India	311510110012542	2000
19.	Canara Bank	110063005772	521.91
20.	Canara Bank	110063005772	521.91
21.	Canara Bank	110291670735	5000
22.	Canara Bank	42302250003901	15000
23.	Canara Bank	6401101001009	19096
24.	Canara Bank	6401101001009	21096
25.	Canara Bank	0878201000917	37000
26.	Central Bank of India	5912654894	5380.81
27.	Central Bank of India	00000005172105182	3000
28.	Federal Bank	20170100039947	30000
29.	HDFC Bank	50200116507647	11241.29
30.	HDFC Bank	13461050008464	15000

31.	HDFC Bank	59208097730141	50000
32.	HDFC Bank	50200099949445	1078
33.	HDFC Bank	50200118823919	511
34.	ICICI Bank	613701505812	50000
35.	ICICI Bank	147501528257	3500
36.	ICICI Bank	033505003721	346800
37.	ICICI Bank	125105500317	29000
38.	IDFC First Bank	10149276249	47200
39.	IDFC First Bank	10077180943	50000
40.	IDFC First Bank	10012796253	50000
41.	IDFC First Bank	10248245322	109496.15
42.	Indian Bank	6755754376	3112.59
43.	Indian Bank	6774903554	1887.41
44.	Indian Bank	6774903554	30000
45.	Indian Bank	6130337329	10000
46.	Indian Bank	606686412	26500
47.	Indian Overseas Bank	157601000019184	21044.88
48.	Indian Overseas Bank	135601000015242	2983.79
49.	Jammu and Kashmir Bank	0019040100042448	9872.92
50.	Karur Vysya Bank	1698135000006240	10006
51.	Punjab National Bank	0190200100005415	9970.06
52.	Punjab National Bank	0190202100000203	2478.09
53.	Punjab National Bank	2243000100841175	4700
54.	Rajkot Nagrik Sahakari Bank	017003100042960	2800
55.	Rajkot Nagrik Sahakari Bank	017003100042960	2800
56.	State Bank of India	20234910549	70500
57.	State Bank of India	38100985731	2443.5
58.	State Bank of India	38456570913	1300
59.	State Bank of India	42144437636	1000
60.	State Bank of India	33300635957	25000

61.	State Bank of India	33300635957	1000
62.	State Bank of India	38949790259	20000
63.	State Bank of India	34828420751	15000
64.	State Bank of India	20409100821	25000
65.	State Bank of India	36515436649	127400
66.	State Bank of India	43823975348	300023.6
67.	State Bank of India	36177807721	600
68.	State Bank of India	30680989130	14200
69.	State Bank of India	31027651872	8435
70.	State Bank of India	40468523384	7853.91
71.	State Bank of India	43725742430	667
72.	State Bank of India	20409100821	20000
73.	State Bank of India	33300635957	25000
74.	State Bank of India	33230075366	228186
75.	The Junagadh Jilla Sahakari Bank Ltd	00000196004684007	5930.17
76.	UCO Bank	13860100016799	44619.19
77.	Yes Bank	018461900007822	2149.48
78.	Yes Bank	018450700006443	6000
79.	Yes Bank	009852000002533	2130
80.	Yes Bank	211074071	17500

- માં 23,07,828/- જમા છે તે રકમ અરજદાર ખાતુ ધરાવતી બેન્ક **KOTAK MAHINDRA BANK** ના ખાતા નંબર **5449008761** માં જમા કરાવી અત્રેની અદાલતને જાણ કરવી.
- સદર તકરારી નાણાં બાબતે શંકાસ્પદ ખાતાના ધારક કોઈ કાર્યવાહી કરે તો અરજદારે સદર રકમ પરત જમા કરાવવી.

સુરત.

તારીખ:-

14માં એડી. સીની. સિવિલ જજ અને

એ.સી.જે.એમ.,સુરત.